



# SAMPANN UTPADAN INDIA LIMITED

(FORMELY KNOWN AS S E POWER LTD)

CIN NO. L40106GJ2010PLC091860

**Date:13.11.2024**

The Manager  
Department of Corporate Relationship  
**BSE Limited**  
25<sup>th</sup> Floor P. J. Towers, Dalal Street  
Mumbai -400 001  
**Scrip Code: 534598**

The Listing Department  
**National Stock Exchange of India Limited**  
Exchange Plaza, Bandra Kurla Complex  
Bandra (East)  
Mumbai -400 051  
**SCRIP SYMBOL: SAMPANN**

**Sub.: Intimation regarding Publication of Financial Results in Newspapers**

Dear Sir/Madam

Please find attached herewith the copy of Newspapers in which the financial results of the Company for the quarter and year ended September 30, 2024, as approved by the Board of Directors of the company in their meeting held on November 11, 2024, were published on November 13 2024, pursuant to applicable regulations of SEBI(LODR) Regulations, 2015.

Kindly keep the same in your record.


Thanking You,

Yours Faithfully,

**For Sampann Utpadan India Limited**  
(Formerly Known as S. E. Power Limited)

**(Saurabh Agrawal)**  
**Company Secretary**

**Encl.:** As above

 <b>SAMPANN UTPADAN INDIA LIMITED</b> (Formerly Known as S. E. Power Limited) CIN : L40106GJ2010PLC091880 Regd. Off: Survey No. 54/B, Pratapnagar, Jarod-Savli Road, Samlaya, Vadodara-391520 (Guj.) Tel.: +91 2667 251566, E-mail: cs@suil.in, Website: www.suil.in																																		
<b>EXTRACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER/HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2024</b>																																		
(₹ in Lacs except EPS)																																		
Particulars	Quarter Ended		Half Year Ended		Year Ended																													
	30.09.2024 (Unaudited)	30.09.2023 (Unaudited)	30.09.2024 (Unaudited)	30.09.2023 (Unaudited)	31.03.2024 (Audited)																													
Revenue from operations	2109.73	1770.09	4129.07	3521.91	7145.33																													
Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(150.58)	37.19	(356.14)	(93.51)	(88.45)																													
Net Profit for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	(150.58)	37.19	(356.14)	(93.51)	(88.45)																													
Net Profit for the period after tax	(112.70)	27.81	(266.70)	(70.09)	(86.78)																													
Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(112.70)	27.81	(266.70)	(70.09)	(86.78)																													
Paid up Equity Share Capital (Face value of Rs. 10/- per share)	4061.00	4061.00	4061.00	4061.00	4061.00																													
Reserves excluding Revaluation Reserves (as per balance sheet of previous accounting Year)	-	-	-	-	(3545.15)																													
Earnings per Share (of Rs. 10 each) (not annualised) Basic & Diluted:	(0.28)	0.07	(0.66)	(0.17)	(0.21)																													
<b>Notes:</b> 1) The key standalone financial information of the Company is as under:																																		
<table border="1"> <thead> <tr> <th rowspan="2">Particulars</th> <th colspan="2">Quarter Ended</th> <th colspan="2">Half Year Ended</th> <th>Year Ended</th> </tr> <tr> <th>30.09.2024 (Unaudited)</th> <th>30.09.2023 (Unaudited)</th> <th>30.09.2024 (Unaudited)</th> <th>30.09.2023 (Unaudited)</th> <th>31.03.2024 (Audited)</th> </tr> </thead> <tbody> <tr> <td>Revenue from operations</td> <td>2109.79</td> <td>1770.09</td> <td>4129.07</td> <td>3521.91</td> <td>7145.33</td> </tr> <tr> <td>Profit before tax</td> <td>(150.25)</td> <td>37.50</td> <td>(355.55)</td> <td>(92.93)</td> <td>(87.13)</td> </tr> <tr> <td>Profit after tax</td> <td>(112.43)</td> <td>28.06</td> <td>(266.22)</td> <td>(69.54)</td> <td>(85.28)</td> </tr> </tbody> </table>						Particulars	Quarter Ended		Half Year Ended		Year Ended	30.09.2024 (Unaudited)	30.09.2023 (Unaudited)	30.09.2024 (Unaudited)	30.09.2023 (Unaudited)	31.03.2024 (Audited)	Revenue from operations	2109.79	1770.09	4129.07	3521.91	7145.33	Profit before tax	(150.25)	37.50	(355.55)	(92.93)	(87.13)	Profit after tax	(112.43)	28.06	(266.22)	(69.54)	(85.28)
Particulars	Quarter Ended		Half Year Ended		Year Ended																													
	30.09.2024 (Unaudited)	30.09.2023 (Unaudited)	30.09.2024 (Unaudited)	30.09.2023 (Unaudited)	31.03.2024 (Audited)																													
Revenue from operations	2109.79	1770.09	4129.07	3521.91	7145.33																													
Profit before tax	(150.25)	37.50	(355.55)	(92.93)	(87.13)																													
Profit after tax	(112.43)	28.06	(266.22)	(69.54)	(85.28)																													
2) The above is an extract of the detailed Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results (Consolidated/Standalone) are available on the website i.e. www.sepower.in and on the Stock Exchanges' websites i.e. www.bseindia.com and www.nseindia.com.																																		
For and on behalf of Board of Directors Sd/- <b>(SACHIN AGARWAL)</b> Managing Director																																		
Place : Vadodara Date : 12.11.2024																																		

<b>DBL INFRA ASSETS PRIVATE LIMITED</b> Registered Office: E-5/90, Arera Colony, Bhopal, 462016 CIN No: U74110MP2010PTC023673					
<b>Statement of Un-Audited Financial Results for the Quarter &amp; Half Year ended 30 Sep 2024</b> [Regulation 52 (8) read with Regulation 52 (4) of the (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015]					
(INR in Lacs, except Per Share Data & Ratio)					
S. No.	Particulars	For Quarter ended / As at 30 Sep 2024	For Quarter ended / As at 30 Sep 2023	For Half Year ended / As at 30 Sep 2024	For the Year ended / As at 31 Mar 2024
		Un-Audited	Un-Audited	Un-Audited	Audited
1.	Total Income From Operations (Net)	874.87	1,459.66	1,248.55	8,323.14
2.	Net Profit / (Loss) For The Period (Before Tax, Exceptional And / Or Extraordinary Items #)	(2,168.01)	(1,596.75)	(5,440.13)	(7,461.09)
3.	Net Profit / (Loss) For The Period Before Tax (After Exceptional And / Or Extraordinary Items #)	(2,168.01)	(1,439.59)	(5,440.13)	(4,866.20)
4.	Net Profit / (Loss) For The Period After Tax (After Exceptional And / Or Extraordinary Items #)	(2,167.93)	(1,440.06)	(5,439.96)	(5,151.99)
5.	Total Comprehensive Income For The Period [Comprising Profit / (Loss) For The Period (After Tax) And Other Comprehensive Income (After Tax)]	(1,656.94)	(1,438.73)	(4,430.06)	(3,625.46)
6.	Paid Up Equity Share Capital	200.00	200.00	200.00	200.00
7.	Reserves (Excluding Revaluation Reserve)	-	-	-	(12,815.01)
8.	Securities Premium Account	-	-	-	-
9.	Net Worth	-	-	-	(12,615.01)
10.	Paid Up Debt Capital / Outstanding Debt	-	-	-	67,569.95
11.	Outstanding Redeemable Preference Shares	-	-	-	N/A
12.	Debt Equity Ratio	-	-	-	(5.36)
13.	Earnings Per Share of Rs. 10/- Each (Non Annualised)				
1. Basic:		(108.40)	(72.00)	(272.00)	(257.60)
2. Diluted:		(108.40)	(72.00)	(272.00)	(257.60)
14.	Capital Redemption Reserve	-	-	-	-
15.	Debt Redemption Reserve	-	-	-	-
16.	Debt Service Coverage Ratio	-	-	-	0.05
17.	Interest Service Coverage Ratio	-	-	-	0.30
# - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind AS Rules / AS Rules, whichever is applicable.					
<b>Notes:</b> 1. The above Un-Audited financial results for the Quarter & Half Year ended <b>Sep 30, 2024</b> have been reviewed and recommended by the Audit committee and subsequently approved by the board of directors at their respective meetings held on <b>November 12, 2024</b> . 2. The Un-Audited Financial Results have been prepared in accordance with IND AS, notified under section 133 of the Companies Act, 2013 read with Companies (Indian Accounting Standards) Rules, 2015, as amended from time to time, and other accounting principles generally accepted in India and in compliance with Regulation 52 of SEBI (Listing Obligation and Disclosure Requirement) Regulation 2015, as amended. 3. The above is an extract of the detailed format of Quarter & Half Yearly and Annual financial results filed with the Stock Exchanges under Regulation 52 of the Listing Regulations. The full format of the financial results are available on the websites of the Stock Exchange(s) (www.bseindia.com) and the company (www.dbiapl.com). 4. For the other line items referred in regulation 52(4) of the Listing Regulations, pertinent disclosures have been made to the Stock Exchange(s) (BSE) and can be accessed on the URL (www.bseindia.com) and can be accessed on www.dbiapl.com.					
For DBL Infra Assets Private Limited  <b>Dilip Suryavanshi</b> Director (DIN:00039944)					
Place: Bhopal Date: 12 November, 2024					

<b>POSSESSION NOTICE (for immovable property)</b> (as per Appendix IV read with Rule 8(1) of the Security Interest (Enforcement) Rules, 2002)						
<b>EDELWEISS ASSET RECONSTRUCTION COMPANY LIMITED</b> Retail Central & Regd. Office: Edelweiss House, Off CST Road, Kalina, Mumbai 400098						
Whereas, That the Original Lenders have assigned the below financial assets to Edelweiss Asset Reconstruction Company Limited which is acting in its capacity as various trustees mentioned below (EARC). Pursuant to the assignment agreements, under Sec.5 of SARFAESI Act, 2002, EARC has stepped into the shoes of the Assignor and all the rights, title and interests of Assignor with respect to the financial assets along with underlying security interests, guarantees, pledges have vested in EARC in respect of the financial assistance availed by the Borrowers and EARC exercises all its rights as a secured creditor.						
The Authorized Officer of the EARC, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Act), 2002 and in exercise of powers conferred under Section 13(12) read with (Rule 3) of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice as mentioned below calling upon the borrower(s) to repay the amounts mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.						
The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned being the Authorised Officer of Edelweiss Asset Reconstruction Company Limited has taken Physical Possession of the properties described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on the date mentioned against each property.						
The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Edelweiss Asset Reconstruction Company Limited for the amount mentioned below and interest thereon.						
Name of Assignor	Name of Trust	Loan A/c Number	Borrower Name & Co-Borrower (s) Name	Amount & Date of Demand Notice	Date of Possession	Possession Status
AU Small Finance Bank	EARC Trust SC 379	L90010 607007 96708	1) Hiten Anantrai Talasaniya (Borrower) 2) Kalpana Hiten Talasaniya, 3) Rekhaben Anantrai Talasaniya 4) Anantrai Talasaniya (Co-borrowers)	Rs.45,36,023.00/- as on 19/07/2019 & 20/07/2019	09/11/2024	Physical Possession
<b>Description of Secured Asset - Schedule Property - Property-1</b> Residential Property (secured Assets) Being House On The Land Area Adm. 42.00 Sq. Mts. of Sub Plot No. 34 P of Plot No. 34 P of Revenue Survey No. 248 P of City Survey Ward No. 11 of Sheet No. 631 P Located At Rajkot, Sub Dist.: Rajkot Dist.: Rajkot In The State of Gujarat. <b>Boundaries of The Aforesaid Property:-</b> North - Sub Plot No. 4-5, South - Sub Plot No. 2, East - Plot No. 33, West - Others Property <b>Property-2</b> Residential Property (Secured Assets) Being House On The Land Area Adm. 63.00 Sq. Mts. of Sub Plot No. 4 P of Plot No. 34 P of Revenue Survey No. 248 P of City Survey Ward No. 11 of Sheet No. 631 P Located At Rajkot, Sub Dist.: Rajkot Dist.: Rajkot In The State of Gujarat. <b>Boundaries of The Aforesaid Property:-</b> North - Road, South - Sub Plot No. 3, East - Sub Plot No. 5, West - Others Property <b>Property-3</b> Residential Property (secured Assets) Being House On The Land Area Adm. 63.00 Sq. Mts. of Sub Plot No. 5 P of Plot No. 34 P of Revenue Survey No. 248 P of City Survey Ward No. 11 of Sheet No. 631 P Located At Rajkot, Sub Dist.: Rajkot Dist.: Rajkot In The State of Gujarat. <b>Boundaries of The Aforesaid Property:-</b> North - Road, South - Sub Plot No. 3, East - Plot No. 33, West - Others Property						
M/s Cholamandalam Investments & Finance Company Limited (CIFCL)	EARC TRUST SC-481	HL03B AO0000 12162	1) Shri Santosh Sha (Borrower), 2) Smt. Sangita Sah (Co-Borrower)	Rs.16,37,804.46 (Rupees Sixteen Lac Thirty Seven Thousand Eight Hundred Four paisa Forty Six Only) as on 08.12.2023 & 11.12.2023	09/11/2024	Physical Possession
<b>Description of Secured Asset - Schedule Property - All the piece and parcel of the immovable property bearing Flat No. 204, 2nd Floor, Ghanshyam Flat, Nr. Talati Office, Vadsar Village Road, Vadsar, Vadodara- 390010 and said Property situated at Flat No.204, 2nd Floor, Ghanshyam Flat, City Survey No.1386 (C.S. No.1386, 1390, 1391, 1392 &amp; 1393) Adm. 980.00 sq. mtrs. in which it is Constructed in the name of "Ghanshyam Flats" paiki, Second Floor, Flat No.204 Adm. 55.74 sq. mtrs. and other Common area 11.13 sq. mtrs. of Mouje Vadsar, Taluka &amp; Sub District. Vadodara, District. Vadodara &amp; Bounded as: By North : Adj. Survey No. Property, By South : Common Passage, By East : Flat No. 203, By West : Flat No. 205             </b>						
M/s HDB Financial Services Limited (HDBFSL)	EARC Trust SC-483	12879746 & 1964360	1) M/s Akshit Pharma and Surgical (Borrower), 2) Shri Dineshkumar Harilal Thakkar (Co-Borrower & Mortgagee) 3) Smt. Hina Ben Dineshkumar Thakkar (Co-Borrower & Mortgagee)	Rs. 15,24,823.00 (Rupees Fifteen Lac Twenty Four Thousand Eight Hundred Twenty Three Only) as on 11.12.2023 & 11.12.2023	10/11/2024	Physical Possession
<b>Description of Secured Asset - Schedule Property - All the piece and parcel of the immovable property bearing Block/Revenue Survey No.559+560/3, area 16288.00 sq.mt. Paiki 11736.00 sq.mt. T.P.No.1, F.P.No.134, Paiki area 9770.39 sq. mt., N.A. land area Paiki Tower D/12, First Floor Up, Flat No.101, admeasuring undivided land area 21.00 sq. mt. and construction area 72.22 sq. mt., as on constructed commercial building of Mouje Karamsad, Tal &amp; Dist. Anand &amp; Bounded as: By North : Internal Road After Sky Margin, By South : Common Wall with 1st Floor Flat No.102, By East : Open Margin Land, By West : 1st Floor Flat No.104 after Common Passage             </b>						
M/s Cholamandalam Investments & Finance Company Limited (CIFCL)	EARC Trust SC-481	X0HLJD G000029 02774	1) Aminbhai Habibbhai Sama (Borrower) 2) Akil Aminbhai Sama (Co-borrower)	Rs.10,46,019.82/- up to 23/10/2023 & 27/10/2023	10/11/2024	Physical Possession
<b>Description of Secured Asset - Schedule Property - All Part &amp; Parcel of Residential Property (secured Assets) Being Flat Having Carpet Area Adm. 60-37 Sq. Mtrs. Situated On The 3rd Floor of The Building Known As "gulistan Apartment" of Plot No. 221 Paikee of City Survey No. 4971 Paikkee of Sheet No. 60 Within The Limits of Upleta Municipality, Located At Upleta, Tal: Upleta, Dist.: Rajkot In The State of Gujarat. <b>Boundaries of The Aforesaid Property:-</b> North : Galary &amp; Road, South : Common Passage &amp; Road, East : Property of Block No. 24, West : Property of Block No. A/10 &amp; A/11, Common Passage, Stair             </b>						
HDB Financial Services Limited	EARC Trust SC 483	8134954	1) M/s. Tapshya Modeling A Proprietorship Firm Through Its Proprietor Mr. Subhash Bavajibhai Panelia (Borrower) 2) Mrs. Sonalben Subhash Panelia 3) Mr. Subhash Bavajibhai Panelia (Co-borrowers)	Rs.21,54,078.24/- as on 04/10/2024 & 05/01/2024	10/11/2024	Physical Possession
<b>Description of Secured Asset - Schedule Property - All Part &amp; Parcel of Commercial Property (Secured Assets) Assets) Being Shops No. TF-37, 38, 39, 40, 41 And 42 of Built-up Area Adm. 73.90 Sq. Mtrs. Situated On Third Floor Of Building Known As "Jetpur Textile Market" of City Survey Sheet No. 31 of City Survey Sheet No. 31 Situated At Navagadh, Sub Dis.: Jetpur Dis.: Rajkot In The State of Gujarat. <b>Boundaries of The Aforesaid Property:-</b> North : Adj. Commercial Shop/hall, South Adj. Common Passage, East: Adj. Common Passage, Staircase &amp; Ots, West: Adj. Property of C.S. No. 2019             </b>						
HDB Financial Services Limited	EARC Trust SC - 481	X0HLAJ R000028 17737	1) Mr. Ghanshyam Mohanbhai Makwana (Borrower) 2) Mr. Ashish Ghanshyambhai Makwana (Co-borrower)	Rs.6,25,364.69/- as of 11/11/2023 & 28/11/2023	11/11/2024	Physical Possession
<b>Description of Secured Asset - Schedule Property - All part &amp; parcel of residential property (Secured Assets) Being House Situated On The Land Area Adm. 53-53 Sq. Mtrs. Equals To 64-02 Sq. Yards of Sub Plot No.m2-5 Of Plot No. 62 of Area Known As "Asopalay Residency" of The Area Known As "jivandhara Residency" of Revenue Survey No. 169 Located At Village: Hadala, Sub-dist.: &amp; Dist.: Rajkot In The State of Gujarat. <b>Boundaries of The Aforesaid Property:-</b> North : 10-50 Mtrs. Road, South : Other's Property, East : Other's Property, West : Other's Property             </b>						
Date : 11.11.2024 Place : Gujarat Authorised Officer Edelweiss Asset Reconstruction Company Limited						

 <b>Union Bank of India</b> A Government of India Undertaking		Asset Recovery Branch : Union Bank Bhavan, 4th Floor, Racecourse Road, Opp. Indoor Stadium, Rajkot. E Mail: arb.rajkot@unionbankofindia.bank		<b>MEGA E - AUCTION SALE NOTICE</b> (For sale of Immovable/Movable Properties)	
<b>E Auction Sale Notice for Sale of Movable/Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 read with provision to Rule 6(2) or 8(6) of Security Interest (Enforcement) Rules, 2002.</b>					
Notice is hereby given to the public in general and in particular to the Borrowers and Guarantors, that the below described movable/immovable property mortgaged / charged to Union Bank of India (secured creditor), possession of which has been taken by the Authorized Officers of Union Bank of India, will be sold on "AS IS WHERE IS", "AS IS WHAT IS", and "WHATEVER THERE IS" basis, for recovery of respective dues mentioned hereunder against the secured assets mortgaged/charged to Union Bank of India, from respective borrower(s) and guarantor(s). The reserve price and earnest money deposit is shown there against each secured asset. The sale will be done by the undersigned through e-auction platform provided here under:					
Sr. No.	Name of the Borrower/Guarantor	Description of the properties	Total dues	Possession	Reserve Price/ EMD/ Bid increase amount in Rs
01	Borrower : M/s. Jadeja Industries Pvt Ltd (firm) Guarantors : 1. Mr. Keshrshin Indrasinh Jadeja (Director & Property Owner), 2. Mr. Hitendrasinh Mahendrasinh Jadeja (Director & Property Owner), 3. Mr. Devendrasinh Ranubhai Rana (Director), 4. Mrs. Krishnaba Pradipsinh Zala (Property Owner), 5. Estate of the deceased Late Mrs. Kiranba Dilipsinh Rana (Property owner & guarantor) represented by : a) Mr. Dilipsinh Balwantsinh Rana & Others	Property No. 1 : P & M for Manufacturing Particle Boards & Allied Items situated at Survey No. 20/1 paiki & 20/3, Near Snob Sanitaryware, Bhojpara Road, At Village : Bhojpara, Tal. : Wankaner, Dist. : Morbi.  Property No. 2 : (a) P & M for Manufacturing Particle Boards & Allied Items situated at Survey No. 20/1 paiki & 20/3, Near Snob Sanitaryware, Bhojpara Road, At Village : Bhojpara, Tal. : Wankaner, Dist. : Morbi, (b) Industrial Land, Factory Shed with Allied Civil Construction situated at Survey No. 20/1 paiki & 20/3, Near Snob Sanitaryware, Bhojpara Road, At Village: Bhojpara, Tal. : Wankaner, Dist. : Morbi, Extent of the site (least of 14A & 14B) : 6000.00 Sq. Mtrs. <b>Boundaries of the Property : Sur. No 20/1 : North : Sur. No. 20/1, Remaining Land, South : Sur. No. 20/3, East : Waste Land, West : Waste Land, Sur. No. 20/3 : North : Sur. No. 20/1, Waste Land, South : Sur. No. 20/2, Waste Land, East : Waste Land, West : Waste Land</b>	Rs. 13,18,68,169.26 with further interest at contractual rate & cost thereof	Physical	Rs. 1,46,00,000 EMD 10% Bid Increase 1%
02	Borrower : M/s. VRG Energy India Pvt. Ltd. (Borrower Firm) Mr. Vijay Janubhai Rathod (Director cum Guarantor), Mr. Ritesh Babubhai Kamani (Director cum Guarantor), Mr. Ghanshyam Vallabhbbhai Kapuriya (Director cum Guarantor), Guarantors : Mr. Babubhai Popatbhai Kamani (Guarantor), Mr. Janubhai Bhayabhai Rathod (Guarantor), Mr. Vallabhbbhai Nathabhai Kapuriya (Guarantor)	Commercial Shop Situated at City Survey No. 2851/1/1/1 Paiki, City Survey Ward No. 6/2, T.P.S. No. 03, F.P. No. 74, "Municipal Shopping Center", 1st Floor, Shop No. 128, Chandreshnagar Main Road, Rajkot, Admeasuring Carpet Area 22.22 Sq. Mtr. Owned by Mr. Babubhai Popatbhai Kamani. Bounded By: North : Shop No. 127, South : Shop No. 129, East : Shop No. 126, West : Entry, Passage, Parking and Chandreshnagar Main Road.	Rs. 5,11,94,394.17 with further interest at contractual rate & cost thereof	Physical	Rs. 1,46,00,000 2 (B) Rs. 1,62,00,000 Total Rs. 3,08,00,000 EMD 10% Bid Increase 1%
03	Borrowers : M/s. Laxmi Silver Works, Mr. Kuman Ramubhai Rajabhai (Borrower), Mr. Shrinivasbhai Rajabhai Kuman (Guarantor) & Lt. Kuman Ramubhai Rajabhai	Residential Flat No.103 1st Floor, Om Heights, 5 Ranchhodnagar Society, Near Rajput Wadi, Off Kuvada Road, Rajkot R. S. No. 123/P, Plot No. 182/P, T.P.S. No. 8, O.P. No. 10, F.P. No. 46, City Survey Ward No. 12/1, Owned by Mr. Ramubhai Rajabhai Kuman, Area : 42.31 Sq. Mtr (Property description as specified in the Registered Sale Deed No. 5620 dated 12/08/2013) North : Open Margin Space, South : Flat No.102, East : Lift passage & Flat No.101, West : Other Property	Rs. 96,29,292.65 with further interest at contractual rate & cost thereof	Physical	Rs. 18,50,000 EMD 10% Bid Increase 1%
04	Borrower : M/s. Vision Bio Products India Pvt. Ltd. 1. Mr. Jigneshbhai Shivlalbhai Sipariya 2. Mr. Parimalbhai Gadheshariya 3. Mr. Sureshbhai Shivabhai Sipariya 4. Mr. Ghanshyam Shivshankar Mehta 5. Mr. Shivlal Bachubhai Sipariya	All That Piece and Parcel of Residential Flat No. H 404 admeasuring 55.47 Sq. Mts., Build Up Area on 4th Floor of unit A of Building H of Backbone Residency, Constructed on lands of Plot No. 7 to 12, 25 to 30 of R. S. No. 27 Paiki of Village Madhapar, Tal. & District : Rajkot in the name of Mrs. Dharmishtha J. Dave. (Property description as specified in the sale Deed No. RKT-3-RNP 5260 dated 16-05-2012.) Bounded : On the North by : Building G, On the South by : Flat No. H 403, On the East by : Lift Stair Than Flat No. H 401, On the West by : Margin Space then Road	Rs. 49,72,223.50 with further interest at contractual rate & cost thereof	Physical	Rs. 13,50,000 EMD 10% Bid Increase 1%
05	Borrower : M/s Jay Bhavani Ice Factory, Jayshbhai Vajji Rathod (Prop), Vajji Devji Rathod, (Guarantor)	(RESIDENTIAL) Revenue Survey No. 309 paiki, Plot No. 10-b&11-a, Jay Bhawani Kuber Bunglows, B/h. Royal Arcade, At: Chhaya, Dist. : Porbandar. <b>Boundaries are as Follows : North : Adj. Plot No. 10-A, South : Adj. Plot No. 11-B, East : Adj. Land of Survey No. 309, West : 06.00 Mt Wide Road</b>	Rs. 50,83,232.60 with further interest at contractual rate & cost thereof	Physical	Rs. 52,00,000 EMD 10% Bid Increase 1%
06	Murlidhar Cottex Partners : 1. Mr. Sureshbhai Devayathbhai Kothival, 2. Mr. Vanrajbhai Devayathbhai Kothival, 3. Mr. Vikrambhai Devayathbhai Kothival, 4. Mr. Maganbhai Kanjibhai Khakhriya, 5. Mr. Nareshbhai Maganbhai Khakhriya, 6. Mr. Rajeshbhai Maganbhai Khakhriya Guarantor : Mr. Bharat Raimalbhai Rathod, Mr. Manharbhai Devayathbhai Kothival, Mr. Devayathbhai Kothival, In capacity of legal heirs of Manharbhai Devayathbhai Kothival	Residential Open Vacant Plot, Near Chitratuk Society, Nearby Reliance Petrol Pump, Behind to Old Circuit House, off : Bhavnagar Highway, Rev Sur No. 703 Paiki 3, Plot No. 8, Ramnagar Society Area, Babra, Tal. Babra, Dist. : Amreli - 365421 legal heirs of Mr. Manharbhai Devayathbhai Kothival of total Area: 99.65 Sq. Mtr. <b>Boundaries of the Property : North : Plot No. 7, South : Road, East : Road, West : Plot No. 9</b>	Rs. 6,11,04,519.20 with further interest at contractual rate & cost thereof	Physical	Rs. 5,60,000 EMD 10% Bid Increase 1%
07	M/S. OM Metal (Borrower), Mrs. Manaliben B. Banta (Partner/ Guarantors), Dharmishtha J. Dave (Partner/ Guarantors), Legal heirs of Late Mr. Bhavesh M. Pujara (Partner/ Guarantors)	All That Piece and Parcel of Residential Flat No. H 404 admeasuring 55.47 Sq. Mts., Build Up Area on 4th Floor of unit A of Building H of Backbone Residency, Constructed on lands of Plot No. 7 to 12, 25 to 30 of R. S. No. 27 Paiki of Village Madhapar, Tal. & District : Rajkot in the name of Mrs. Dharmishtha J. Dave. (Property description as specified in the sale Deed No. RKT-3-RNP 5260 dated 16-05-2012.) Bounded : On the North by : Building G, On the South by : Flat No. H 403, On the East by : Lift Stair Than Flat No. H 401, On the West by : Margin Space then Road	Rs. 2,74,03,806.20 with further interest at contractual rate & cost thereof	Physical	Rs. 92,00,000 EMD 10% Bid Increase 1%
08	Borrower : M/s. Vision Bio Products India Pvt. Ltd. 1. Mr. Jigneshbhai Shivlalbhai Sipariya 2. Mr. Parimalbhai Gadheshariya 3. Mr. Sureshbhai Shivabhai Sipariya 4. Mr. Ghanshyam Shivshankar Mehta 5. Mr. Shivlal Bachubhai Sipariya	Plant & Machinery Located at Sr No. 200 Paiki5, Behind Chaitanya Hanumanji Temple, Nr. J.K. Agro Foods Unit, At - Surva, Tal. : Talala, Dist. : Gir Somnath - 362140.	Rs. 2,74,03,806.20 with further interest at contractual rate & cost thereof	Physical	Rs. 92,00,000 EMD 10% Bid Increase 1%
09	9 (a) Plant & Machinery Located at Sr No. 200 Paiki 5, Behind Chaitanya Hanumanji Temple, Nr. J.K. Agro Foods Unit, At - Surva, Tal. : Talala, Dist. : Gir Somnath - 362140. 9 (b) Factory Land & Building Situated at Village : Surva, Survey No. 200 Paiki 5, Tal. : Talala, Dist. : Gir Somnath - 362140. Area : 5505.27 Sq. Mtr. (Property description as mentioned in Sale Deed No 830 dated 06.06.2018) Boundries : North : R. S. No. 200 Paiki Agri Land, South : R. S. No. 200 Paiki Agri Land, East : 12 Meter Wide Road, West : R. S. No. 200 Paiki Agri Land			Physical	9 (A) Rs. 92,00,000 9 (B) Rs. 1,86,00,000 Total Rs. 2,78,00,000 EMD 10% Bid Increase 1%
<b>Date and time of Auction : 29.11.2024 from 12.00 NOON to 5.00 PM (UNLIMITED EXTENSION OF 10 MINUTES)</b> <b>Property Inspection (BY TAKING PRIOR APPOINTMENT) Inspection Date : 19.11.2024, Time : 11.00 AM to 4.00 PM</b> For detailed Terms and Conditions of Sale, Please refer to the link provided in https://www.unionbankofindia.co.in/auction-property/view-auction-property.aspx & https://ebkraj.in • Perspective bidders may contact for more details to Mr. Parveen Verma - Mob : 7015894944, Mr. M. R. Jadeja - Mob : 98252 89952 and Mr. Jagdish Kumar - Mob : 73895 89964. • (GST/TDS shall be payable as per applicable Government Rules - purchaser on sale of Movable/Immovable Assets)					
<b>AS PER SARFAESI Act, STATUTORY 15 - DUYA SALE NOTICE TO THE BORROWER/ GUARANATOR/ MORTGAGOR</b>					
The above mentioned Borrower's is/ are hereby notified to pay the sum as mentioned in section 13 (2) Notice in full before the date of auction, failing which property will be auctioned/ sold and balance dues if any will be recovered with interest and cost from Borrower/s/ Guarantor/s/ Mortgagee.					
Date : 10.11.2024 Place : Rajkot		(In The Event Of Any Discrepancy Between The English Version And Any Other Language Version of This Auction Notice, The English Version Shall Prevail)		Chief Manager & Authorised Officer, Union Bank of India	

રશિયાથી તેલની ખરીદી પર પ્રતિબંધો પછી ભારત રિફાઇન્ડ ઓઇલ ઉત્પાદનોના મુખ્ય નિકાસકાર

# યુરોપમાં ભારતના ઈંધણની નિકાસ વધી

નવેમ્બર ૨૦૨૪માં યુરોપમાં રિફાઇન્ડ ઈંધણની નિકાસ ૪૦૦,૦૦૦ બેરલ પ્રતિ દિવસ પર પહોંચી

મુંબઈ,તા.૧૨  
રશિયા-યુક્રેન યુદ્ધ પછી ભારત યુરોપમાં તેના શુદ્ધ ઈંધણની નિકાસમાં સતત વધારો કર્યો છે. યુરોપિયન યુનિયન દ્વારા રશિયા પાસેથી તેલની ખરીદી પર પ્રતિબંધો લાદવામાં આવ્યા પછી, ભારતે યુરોપમાં રિફાઇન્ડ ઓઇલ ઉત્પાદનોના મુખ્ય નિકાસકાર તરીકે ઉભરીને તેની નિકાસ ક્ષમતામાં વધારો કર્યો છે. Kpler ડેટા અનુસાર નવેમ્બર ૨૦૨૪માં ભારતથી યુરોપમાં રિફાઇન્ડ ઈંધણની નિકાસ ૪૦૦,૦૦૦ બેરલ પ્રતિ દિવસ (૫૨ પહોંચી હતી, જે સર્વાલીન ઉચ્ચ સ્તરે છે. નંબર ૮ નવેમ્બરના રોજ અપડેટ કરવામાં આવ્યો હતો અને મહિનાના અંતે તેને ફરીથી સુધારવામાં આવશે. અગાઉ



ભૂમિકા ભજવી છે. રિલાયન્સની રિફાઇનરી ઓક્ટોબરમાં દરરોજ ૩૩૫,૦૦૦ બેરલ અને નવેમ્બરમાં ૪૪૦,૦૦૦ બેરલ પ્રતિ દિવસ નિકાસ કરે તેવી ધારણા છે. યુરોપમાં રિફાઇનરીઓની જાળવણીને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જે યુરોપમાં રિફાઇન્ડ ઓઇલ

ઈંધણની નિકાસ ૨,૫૫૧ હજાર બેરલ પ્રતિ દિવસ (KBD) હતી, જ્યારે ગયા વર્ષે સમાન સમયાવાને આ આંકડો ૨,૬૨૭ KBD હતો. ૨૦૨૨ માં, આ આંકડો ૧,૪૫૮ KBD હતો, જે હવે નોંધપાત્ર રીતે વધી ગયો છે. ભારતે ઓક્ટોબરમાં યુરોપમાં ૨૩૮,૦૦૦ bpd ડીઝલ અને ૮૧,૦૦૦ bpd જેટ ઈંધણની નિકાસ કરી હતી, જ્યારે સપ્ટેમ્બરમાં આ આંકડા અનુક્રમે ૭૮,૦૦૦ bpd ડીઝલ અને ૧૩૧,૦૦૦ bpd જેટ ઈંધણ હતા. છેલ્લે, અમે તમને જણાવી દઈએ કે ભારતની શુદ્ધ ઈંધણની નિકાસ હાલમાં યુરોપ માટે એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની ગઈ છે, અને આ નિકાસ આગામી મહિનાઓમાં વધુ વધવાની સંભાવના છે.



મુંબઈ,તા.૧૨  
ભારતનું ગેમિંગ માર્કેટ ઝડપથી વધી રહ્યું છે અને એક નવા રિપોર્ટ અનુસાર, તે ૨૦૨૮-૨૯ સુધીમાં US\$૮.૨ બિલિયન સુધી પહોંચી શકે છે. આ વૃદ્ધિ જાહેરાત આવકમાં વધારો અને એલિટ્સનમાં ખરીદીને કારણે થશે. આ અંદાજ સોમવરે જાહેર કરાયેલ વેન્ચર કેપિટલ ફર્મ લુમિકાર્થના રિપોર્ટમાં આપવામાં આવ્યો છે. લુમિકાર્થનો 'સ્ટેટ ઓફ ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ મીડિયા એન્ડ ગેમિંગ રિપોર્ટ' જણાવે છે કે ભારતનું ગેમિંગ માર્કેટ FY2023માં \$૩.૧ બિલિયનથી FY2024માં 23% વધીને US\$૩.8 બિલિયન થશે. આ અહેવાલ મુજબ, ભારતીય ગેમિંગ બજાર ૨૦૨૮-૨૯ સુધીમાં \$9.2 બિલિયન સુધી પહોંચે તેવી શક્યતા છે, જે ૨૦%ના ચક્રવૃત્તિ દરે વૃદ્ધિ પામશે, જે ઈન-એપ ખરીદી અને જાહેરાતની

## ભૌતિક સંપદા સંરક્ષણ માટે મજબૂત ઈકોસિસ્ટમ

### ભારતમાં પેટન્ટ ફાઇલિંગની સંખ્યા પાંચ વર્ષમાં બમણી થઈ હવે દેશ વિશ્વમાં છઠ્ઠા ક્રમે



મુંબઈ,તા.૧૨  
ભારતમાં ૨૦૧૮ અને ૨૦૨૩ ની વચ્ચે પેટન્ટ અને ઔદ્યોગિક દાવાઓની સંખ્યા બમણી થઈ ગઈ છે, જ્યારે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનમાં ૬૦%નો વધારો જોવા મળ્યો છે. પરિણામે, ભારત હવે પેટન્ટ ફાઇલિંગની દ્રષ્ટિએ વિશ્વમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે, જેમાં ૬૪,૪૮૦ પેટન્ટ ફાઇલ કરવામાં આવી છે, જે ૧૫.૭% ની વૃદ્ધિ દર્શાવે છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું મુજબ આ વૃદ્ધિ મુખ્યત્વે દેશમાં થઈ રહેલી નવીનતાઓને કારણે છે. ભારતની બૌદ્ધિક સંપત્તિ (IP) ઓફિસ ટ્રેડમાર્કની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે બીજા ક્રમે છે. ૨૦૨૩ માં કુલ ૩.૨ બિલિયન ટ્રેડમાર્ક નોંધણી કરવામાં આવી છે. આ સાથે, છેલ્લા દાયકામાં ભારતનો પેટન્ટ-ટુ-જીપીડી રેશિયો ૧.૪૪ થી વધીને ૩.૮૧ થયો છે, જે દેશમાં બૌદ્ધિક સંપદાનું મહત્વ દર્શાવે છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે "WIPO ઈન્ડિકેટર્સ ૨૦૨૪" રિપોર્ટ

## મુંગજ ગામથી લાલજી મહારાજ જાન લઈને કાંટીપાડા આવશે ત્યાં તુલસી વિવાહ સંપન્ન થશે

# નેત્રંગના કાંટીપાડામાં 51મા તુલસી વિવાહ નિમિત્તે સત્યનારાયણ કથામાં 351 જોડાઓએ લાભ લીધો



ભરૂચ,તા.૧૨  
ભારતીય સંસ્કૃતિમાં તુલસી વિવાહનું સહવિશેષ મહત્વ છે. ભરૂચ જિલ્લાભરના ભગવાન વિષ્ણુ અને સત્યનારાયણ ભગવાનના મંદિરોમાં વહેલી સવારથી જ ભગવાનનો શણગાર કરી પૂજાપાઠ અને ભજનો ચાલી રહ્યા હતા. ભક્તોએ એકાદશીનો ઉપવાસ કરી ફળાહાર કરી ભગવાનની ભક્તિ સાથે ગલીઓ, ફળિયાઓમાં તુલસી વિવાહની ફેરીઓ કરી હતી અને દોલ નગારાના તાલે ભગવાન વિષ્ણુ સાથે રીતરિવાજો સાથે તુલસી વિવાહ સંપન્ન કર્યા હતા. ભરૂચ-નર્મદા જીલ્લાના આદિવાસી વિસ્તારોમાં પણ દેવઉઠી

તાલુકાના કાંટીપાડા ગામે તુલસી માતા સાથે લગ્નગ્રંથીએ જોડાશે ત્યારબાદ તુલસી વિવાહ સંપન્ન થશે. જેમાં ભાવિક-ભક્તોમાં ભારે ઉત્સાહ-ઉમંગનું વાતાવરણ જણાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામે શ્રી સંત પુનિત માનવ કલ્યાણ ટ્રસ્ટ જેસપોર અને કાંટીપાડા ગ્રામજનો થકી પુનિત છેલ્લા સાત દિવસથી રામાયણ કથામાં મોટી સંખ્યામાં ભાવિકભક્તો લાભ લઈ રહ્યા છે. ભગવાન સત્યનારાયણની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જે કથામાં ૩૫૧ જોડાઓએ કથાનો લાભ લીધો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

## નેત્રંગ-અંકલેશ્વર કમરતોડ રસ્તાના નવીનીકરણની કામગીરી શરૂ નહીં થતાં લોકોમાં આકોશ



ભરૂચ,તા.૧૨  
ભરૂચ જિલ્લામાં ચોમાસુ શરૂ થતાની સાથે જ બની ગયેલ ભિસ્માર રસ્તાઓમાં નેત્રંગ-અંકલેશ્વર રોડ હાલ તો કમરતોડ રસ્તો બની ગયો છે. સમયસર અટકાવ ટેકસની ચુકવણી કરતા મુસાફરો અને વાહનચાલકો સરકારની અને સરકારી બાબુઓની ઠીલાશભરી

વાહનચાલકોમાં ભારે આકોશ ભભુકી ઉઠ્યો હતો. તેવા સંજોગોમાં ભરૂચ સાંસદ મનસુખ વસવા અને ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસવાએ રાજ્ય સરકારમાં રસ્તાના નવીનીકરણ માટે લેખિત-મૌખિક રજૂઆત કરતાં સરકારે તાત્ક્રિક મંજૂરી આપી હતી. તમામ ઘટતી કામગીરી પૂર્ણ કરીને શિવાલય ઈન્ફ્રા પ્રોજેક્ટ પ્રા.લી. કંપની વડોદરાને વર્કઓર્ડર આપી રૂ. ૫૦ કરોડના ખર્ચે ૧૮ માસમાં રસ્તાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે તેમ જાણવા મળ્યું હતું. રસ્તાના નવીનીકરણની

## કુરિયર હેલ્પલાઇનના નામે વિશ્વાસ કેળવી

# ડેડીયાપાડાની એક મહિલાના ખાતામાંથી 99 લાખ ઉપાડી લીધા

રાજપીપળા,તા.૧૨  
ભારત દેશમાં અનેક પ્રકારે ઠગો લોકોને છેતરી ઓનલાઇન ફોડ કરતા આવ્યા છે. પોલીસે આ માટે અનેક તરકીબો અપનાવી અને લોકોને જાગૃત કરવા પણ અનેક કાર્યક્રમો કર્યા છતાં ઠગો નવા નવા ક્રિમિયા શોધી લોકોના રૂપિયા પડાવી લે છે અને આવો જ એક કિસ્સો નર્મદા જિલ્લામાં બન્યો છે, જેમાં કુરિયર હેલ્પલાઇનના નામે એક મહિલાના ખાતા માંથી રૂપિયા ઉપાડી લીધા હતા.

દિવાબેન કિર્તિભાઈ મોચીએ, (હાલ રહે.ડેડીયાપાડા થાણા ફળીયુ, તા.ડેડીયાપાડા, જી.નર્મદા. મુ.પ.વ.હ.અંબાસણ, મોચી વાસ, તા.જી.મહેસાણા) આપેલી ફરિયાદ મુજબ તેમના એક મિત્રએ તેમને કુરિયર મોકલ્યું હતું, જે કુરિયરને

ડેન્ડર મુજબ કામગીરી કરાવે તેવી લોકમાં ઉડવા પામી છે. જોકે રોડની કામગીરી સમયસર પૂર્ણ થશે કે નહિ તેમજ આવનાર ચોમાસામાં આ રોડ ટકશે કે નહીં તેની પણ લોકચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે પણ વિપક્ષ રોડની કામગીરી પર બાજુ નજર રાખે તે હવે જરૂરી બન્યું છે.

SAMPANN UTPADAN INDIA LIMITED					
(Formerly Known as S. E. Power Limited) CIN : L40106GJ2010PLC091880					
Regd. Off: Survey No. 54/B, Pratapnagar, Jarod-Savli Road, Samlaya, Vadodara-391520 (Guj.)					
Tel.: +91 2667 251566, E-mail: cs@suil.in, Website: www.suil.in					
EXTRACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER/HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2024					
(₹ in Lacs except EPS)					
Particulars	Quarter Ended		Half Year Ended		Year Ended
	30.09.2024	30.09.2023	30.09.2024	30.09.2023	
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
Revenue from operations	2109.73	1770.09	4129.07	3521.91	7145.33
Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(150.58)	37.19	(356.14)	(93.51)	(88.45)
Net Profit for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	(150.58)	37.19	(356.14)	(93.51)	(88.45)
Net Profit for the period after tax	(112.70)	27.81	(266.70)	(70.09)	(86.78)
Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(112.70)	27.81	(266.70)	(70.09)	(86.78)
Paid up Equity Share Capital (Face value of Rs. 10/- per share)	4061.00	4061.00	4061.00	4061.00	4061.00
Reserves excluding Revaluation Reserves (as per balance sheet of previous accounting Year)	—	—	—	—	(3545.15)
Earnings per Share (of Rs. 10 each) (not annualised) Basic & Diluted:	(0.28)	0.07	(0.66)	(0.17)	(0.21)

Notes:  
1) The key standalone financial information of the Company is as under:

Particulars	Quarter Ended		Half Year Ended		Year Ended
	30.09.2024	30.09.2023	30.09.2024	30.09.2023	
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
Revenue from operations	2109.79	1770.09	4129.07	3521.91	7145.33
Profit before tax	(150.25)	37.50	(355.55)	(92.93)	(87.13)
Profit after tax	(112.43)	28.06	(266.22)	(69.54)	(85.28)

2) The above is an extract of the detailed Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results (Consolidated/Stand-alone) are available on the website i.e. www.spower.in and on the Stock Exchanges' websites i.e. www.bseindia.com and www.nseindia.com.

Place : Vadodara  
Date : 12.11.2024

For and on behalf of Board of Directors  
Sd/-  
(SACHIN AGARWAL)  
Managing Director

**મારું નામ શેખ બેનઝીર બહેન ઈલમુદીન બદલીને શેખ બેનઝીર સાહિલ કરેલ છે. કરબા ફળિયા, સંખેડા, વડોદરા.**

**મારું નામ શેખ બેનઝીર બહેન ઈલમુદીન બદલીને શેખ બેનઝીર સાહિલ કરેલ છે. અ/૩૦૪ અલ-હાતીમ એનકલેવ, અમીના નગર પાછળ, ૩૦ મીટર વાસણા, તાંદલજા રોડ, વડોદરા.**

**નામમાં ફેરફાર**  
લગ્ન પહેલાં હું ગેહાની લવલી ભગવાનદાસ (લવલી ભગવાનદાસ ગેહાની જેમ જ) ઓળખાતી હતી. આંતર લગ્ન બાદ હું શ્રીમતિ સુલાની ગીરીશા વિનોદકુમાર (વિનોદકુમાર ગોરસંદાસ સુલાની જેમ જ) ઓળખાઈ છું જેની નાંધ લેવી.  
રહેઠાણ : પ/બી, સહયોગ ટેનાએન્ટસ, સ્વાતિ સોસાયટી પાછળ, ન્યુ સાય રોડ, વડોદરા-૩૯૦૦૦૮.

**Change of Name**  
I, Smt. VENA BEHN wife of No. 1453593BL Ex Honey Nb Sub Late RATHVA JAGA BHAJI BHUDARA BHAJI presently residing At VIII- Jimiyapura Post: Bapolia Teh: Halol Dist: Panchmahal State: Gujarat-389370 have changed my name from VENA BEHN To VINABEN JAGABHAI RATHVA  
sworn affidavit dated 08-11-2024 vide before Notary N.H. Varia at Halol Dist. Panchmahal.

**જોડાઓ ગૃહપતિ**  
શ્રી ગીતા કેળવણી મંડળ હાથેજ c/o.કોટામહિડા, તા. હાલોલ, જી. પંચમહાલ સંચાલિત શ્રી શાળા જ્યોત કુમાર છાત્રાલય, બાસ્કા, તા.હાલોલ, જિ.પંચમહાલમાં ગૃહપતિની જગ્યા ભરવા માટે જિલ્લા પંચમહાલના જિના/વિજા/છલત/ઓનોસી/૨૪-૨૫/૧૩૫૨ લાઇપી : ૧૬-૧૦-૨૦૨૨ થી નીચે મુજબ N.O.C. મેળવે છે.

ક્રમ	જન્મનું નામ	કેટેગરી	લાઇકાત	માનદવેતન/પગારહોટર
૧	ગૃહપતિ	સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત	એચ.એસ.સી. પાસ	9000/-

૧. ઉપરોક્ત લાઇકાત ધરાવતા ઉમેરવારોએ શાળા છોડવાના પ્રમાણપત્ર, શૈક્ષણિક તેમજ જરૂરી લાઇકાતના પ્રમાણપત્રોની નકલો સહીત સ્વદેશીયમાં રજુદાર પો.ઓ.દી.થી જાહેરાત પ્રસિદ્ધ થયેથી ૧૦ માં નીચાના સરનામે અરજી કરવાની રહેશે.  
અરજી મોકલવાનું સરનામું :  
શ્રી જય જ્વાલમ વિદ્યાવિહાર, બાસ્કા, તા.હાલોલ, જિ.પંચમહાલ

SBI ભારતીય સ્ટેટ બેંક				
કલ્પા અંગેની નોટિસ [સુલ ૮ (૧)] (સ્થાયિન મિલકત નું વર્ણન)				
ક્રમ	કરજદાર/ખામીનાર નું નામ અને લોન ઓફાઇન્ટ નં	કિમાન નોટીસ તારીખ અને રકમ(રૂ)	મિલકતનું વર્ણન	પરિણામ તારીખ અને પ્રકાર
૧.	શ્રી સંતોષ જે શર્મા અને શ્રીમતી મીના કુમારી એસ શર્મા લોન ઓફાઇન્ટ નં. ૩૭૩૩૨૭૧૦૬૬૧, ૩૮૨૭૦૮૩૩૩૬, ૩૭૩૩૩૧૬૭૩૦૧	લા.૨૧.૦૮.૨૦૨૪ અને રૂ. ૨૨,૫૦,૭૭૪.૮૦ + તેના પર ના વધુ વ્યાજ અને આકસ્મિક ખર્ચા લા.૨૦.૦૮.૨૦૨૪ ના રોજ	કરજદાર/મોર્ટેજરની સ્થાયિન મિલકત જેમાં જમીન અને બિલ્ડિંગ અને તેના પર ઉભા કરવામાં આવ્યા છે (વર્તમાન અને ભવિષ્ય બંને) જ્યાં આવેલ છે તેના તમામ ભાગ અને હિસ્સા નો આર.એસ. નં. ૩૨/૩૧/૧ તે ફલેટ નં. ૧૦૬, ૧૧૦ માળ, ટાવર-એક, સહજાનંદ લેન્ડમાર્ક, સયાજીપુરા, વડોદરા. ચર્ચુસીમા: પૂર્વ: ફલેટ નં. એફ/૧૦૧, પશ્ચિમ: વલ્લ આંગળ સોસાયટી, ઉત્તર: સુષિ કુલોસેક, દક્ષિણ: ફલેટ નંબર એફ/૧૦૫.	૦૬.૧૧.૨૦૨૪ સાંકેલી કબજો
૨.	શ્રી ભુવેન્દ્ર શાંકરિય યોહાણા લોન ઓફાઇન્ટ નં. ૬૫૧૬૫૬૪૪૪૪	લા.૦૨.૦૬.૨૦૨૪ અને રૂ. ૨,૬૬,૦૬૫.૦૦ + તેના પર ના વધુ વ્યાજ અને આકસ્મિક ખર્ચા લા.૦૧.૦૬.૨૦૨૪ ના રોજ	કરજદાર/મોર્ટેજરની સ્થાયિન મિલકત જેમાં જમીન અને બિલ્ડિંગ અને તેના પર ઉભા કરવામાં આવ્યા છે (વર્તમાન અને ભવિષ્ય બંને) જ્યાં આવેલ છે તેના તમામ ભાગ અને હિસ્સા નો રજીસ્ટર્ડ ટુટલો સબ ટુટલો વડોદરા, જમીન નો સી.એસ. નં. ૧૫૮, એટીયા ફોનકેન્ડ-૬૨.૪૦ ચોરસ મીટર ગ્રામ પંચાયત ધર નં. ૨૬૪, મોજે-ઉદરા, વડોદરા. ચર્ચુસીમા: પૂર્વ: ૬૫૧૬૫૬૪૪૪૪, પશ્ચિમ: રોડ, ઉત્તર: સી.એસ. નં. ૧૬૧, દક્ષિણ: સી.એસ. નં. ૧૫૭.	૦૮.૧૧.૨૦૨૪ સાંકેલી કબજો
૩.	શ્રી જયદેવ જાન એ પહાન લોન ઓફાઇન્ટ નં. ૩૮૪૬૩૩૬૧૧૪૬, ૩૮૪૭૧૪૪૪૪૪૪	લા.૧૬.૦૬.૨૦૨૪ અને રૂ. ૧૬,૫૭,૬૬૬.૦૦ + તેના પર ના વધુ વ્યાજ અને આકસ્મિક ખર્ચા લા.૧૮.૦૬.૨૦૨૪ ના રોજ	કરજદાર/મોર્ટેજરની સ્થાયિન મિલકત જેમાં જમીન અને બિલ્ડિંગ અને તેના પર ઉભા કરવામાં આવ્યા છે (વર્તમાન અને ભવિષ્ય બંને) જ્યાં આવેલ છે તેના તમામ ભાગ અને હિસ્સા નો આર.એસ. નં. ૭૭૨/૧ જુઓ બ્લોક નં. ૬૦૧, નવો બ્લોક નં. ૭૪૮ પ્લોટ નં. એ-૩૦ મીમ સીડી, પલાસપાડા, તાલુકો: કમોઈ, વડોદરા, રજીસ્ટ્રેશન સબ ટુટલો અને ટુટલો વડોદરા. ચર્ચુસીમા: પૂર્વ: પ્લોટ એ-૨૬, પશ્ચિમ: દાવેર સોસાયટી રોડ, ઉત્તર: ૭.૫ મીટર સોસાયટી રોડ, દક્ષિણ: પ્લોટ નં. એ-૩૧.	૦૮.૧૧.૨૦૨૪ સાંકેલી કબજો
૪.	શ્રી જ્ઞાનેશ્વર ખંડુ બિંદે લોન ઓફાઇન્ટ નં. ૩૦૭૦૮૪૬૨૬૨૬	લા.૦૧.૦૮.૨૦૨૪ અને રૂ. ૨,૫૫,૪૩૦.૦૦ + તેના પર ના વધુ વ્યાજ અને આકસ્મિક ખર્ચા લા.૩૧.૦૭.૨૦૨૪ ના રોજ	કરજદાર/મોર્ટેજરની સ્થાયિન મિલકત જેમાં જમીન અને બિલ્ડિંગ અને તેના પર ઉભા કરવામાં આવ્યા છે (વર્તમાન અને ભવિષ્ય બંને) જ્યાં આવેલ છે તેના તમામ ભાગ અને હિસ્સા નો રજીસ્ટર્ડ ટુટલો સબ ટુટલો વડોદરા, મોજે વડોદરા કલ્પા આર.એસ. ૧૬૩ સી.ટી.એસ. નં. ૨૭૦૩, વિભાગ-એ, ટીકા નં. ૩૨/૦૫, ચંદ્ર દર્શન કો.ઓ. હાઉસિંગ સોસાયટી માટે જમીન કેવલોપમેન્ટ ફલેટ નં. સી-૨૩ ઝીજો માળ, સુપર મિલિટર અપ એટીયા ૬૫.૬૫ ચોરસ મીટર, પ્રતાપ નગર, વડોદરા. ચર્ચુસીમા: પૂર્વ: માર્ગનું રોડ, પશ્ચિમ: ફલેટ નં-૨૨, ઉત્તર: ફલેટ નં-૨૪, દક્ષિણ: માર્ગનું જમીન.	૦૮.૧૧.૨૦૨૪ સાંકેલી કબજો
૫.	શ્રી ભરતકુમાર કાશાલાલ શેખા લોન ઓફાઇન્ટ નં. ૪૧૦૨૩૦૭૩૨૦૬, ૪૧૦૨૩૨૨૬૩૩૪	લા.૦૨.૦૬.૨૦૨૪ અને રૂ. ૨૧,૬૬,૩૬૬.૦૦ + તેના પર ના વધુ વ્યાજ અને આકસ્મિક ખર્ચા લા.૦૧.૦૬.૨૦૨૪ ના રોજ	કરજદાર/મોર્ટેજરની સ્થાયિન મિલકત જેમાં જમીન અને બિલ્ડિંગ અને તેના પર ઉભા કરવામાં આવ્યા છે (વર્તમાન અને ભવિષ્ય બંને) જ્યાં આવેલ છે તેના તમામ ભાગ અને હિસ્સા નો રજીસ્ટર્ડ ટુટલો સબ ટુટલો વડોદરા, મોજે તરસાલી, રજીસ્ટર્ડ ટુટલો વડોદરા, સર્વે નં. ૫૨૨, ડી.વી. નં. ૩૯, એ.પી. ૧૩૧, તે ફલેટ ૭૦૩, ૭મો માળ, ટાવર/વિંગ ઈ "પુષ્પમ હાઉસ-૨" તરસાલી, વડોદરા. ચર્ચુસીમા: પૂર્વ: કોમન પેલેજ અને દાદર, પશ્ચિમ: આશા તરફ મુલુ, ઉત્તર: ફલેટ નં-૭૦૪, દક્ષિણ: ફલેટ નં-૭૦૨.	૦૮.૧૧.૨૦૨૪ સાંકેલી કબજો

તા.: ૧૩.૧૧.૨૦૨૪  
સ્થળ: વડોદરા

વિદ્યાવહી સ્થિતિમાં આ નોટીસની અંગ્રેજી અનુવાદ માન્ય ગણાશે. અધિકૃત અધિકારી ભારતીય સ્ટેટ બેંક